

Date: August 11, 2023

To,
BSE Limited
P J Towers,
Dalal Street,
Mumbai - 400 001
Scrip Code: 543416

To,
National Stock Exchange of India Limited
“Exchange Plaza”, Bandra - Kurla Complex,
Bandra East,
Mumbai - 400051
Symbol: ZODIAC

Dear Sir,

Sub: Intimation under Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 - Newspaper Advertisements for Unaudited Financial Results for the quarter ended on June 30, 2023.

Ref: Zodiac Energy Limited (Security Id/Symbol: 543416 /ZODIAC)

Please find enclosed herewith copy of Newspaper Advertisements published in Free Press Gujarat- (in English) and Lokmitra - (in Gujarati) on August 11, 2023 with respect to publication of Unaudited Financial Results of the Company for the quarter ended on June 30, 2023 which were considered, approved and taken on record by the Board of Directors in their meeting held on August 10, 2023.

The said newspaper advertisement has also been uploaded on the website of the Company at www.zodiacenergy.com.

Thanking You,

Yours Faithfully

For, **Zodiac Energy Limited**

Kunjbihari Shah
Managing Director
DIN: 00622460

Encl:

A/a



Listed On
NSE **BSE**
Symbol: ZODIAC CODE: 543416

CIN: L51909GJ1992PLC017694
ISO 9001 & 14001 : 2015 Certified

5, Upper Ground Floor, Milestone Building, Near
Drive-In Cinema, Thaltej, Ahmedabad - 380054



1800 233 2309
+91 79 27471193 / +91 98791 06443



www.zodiacenergy.com
info@zodiacenergy.com



Text of the Vice-President's Address at the Valedictory function of the festivals of Libraries at Pragati Maidan, Delhi (Excerpts)



Good evening! My greetings to all! The works that have been undertaken and details that have been unfolded here indicate real vision. Just imagine one of the books that I have just released, 'Bibliography on Demand'. It makes available to person, information about a particular subject from all libraries in the country. I have no doubt, with the leadership and vision of Hon'ble Minister, greater heights would be scaled. As a matter of fact, during Amrit Mahotsav, the role of the Ministry has been very motivational, inspirational and impactful. As a matter of fact, the moment I stepped into the space occupied by this function, I have not seen such kind of human involvement, children, ladies, old people committed for libraries, that's a big achievement. I am delighted to be at the Valedictory Ceremony of Festival of Libraries 2023.

The festival inaugurated by Hon'ble President, Smt

I come to a function, I go to social media, which these days is enormously important. I get in touch with the people who know about it. I'm happy to communicate with the Honourable Minister and the Secretary that good vibes have been generated all around by this function.

It has been extremely impactful and there has been absolutely nothing negative about it. Congratulations! Those of you who know chemistry know catalysts do a great job. It converts arithmetic into geometric development. I have no doubt the present programme will catalyse the step towards realising One Nation, One Digital Library and fruitfully the vision of India's Prime Minister, Shri Narendra Modi. Nothing can be more befitting than having such a programme in a country with a civilizational history of 1000s of years. At a time when we are in the second phase of the 'Azadi Ka Amrit Mahotsav'.

It is in line with the Prime Minister's vision to foster the development and digitization of libraries and cultivate a culture of reading in India. I am a product of a time when the library was very relevant. As students in Sainik school, we used to have one hour in a week dedicated to the library. I still read, recollect, I would get small books, biographies that were inspired by those people in various walks of life. Going into the library, I had the occasion

to see who Picasso was. I came to know about Vivekanand ji, Rabindranath Tagore, and those impressions are lasting impressions. So this is an important development that their culture of reading is being facilitated by a platform. We have seen these days that platforms are extremely essential for high productivity. And one platform with the Honourable Secretary was telling me that if someone needs to know about highway engineering or highway infrastructure building, it is available in our bibliography on demand, and you will come to know in which library that particular book is available on the subject. Just imagine such kind of intelligence has been embedded into your mechanism; people are bound to be facilitated and thereby inspired. Formulation of action oriented policies for development of modern libraries in India is a tall order. We are a country of variety - languages, regional cuisines, and different kinds of climatic conditions. But success lies in reaching out to every village. It is gratifying to note we have reached major milestones.

Every village is electrified is not a factor now, every household is electrified and that's a big achievement. Secondly, technological embedding has taken place in the village. Otherwise, how do we explain that 46% of digital transfer in the world is taking place in India. In 2022, if I go by statistics in the digital transfers that took place in the USA, UK, France and Germany, ours are fourth. I have no doubt that this is a big challenge and you will accomplish it undoubtedly and in the shortest time. An informed citizen is the greatest spinal strength of any democratic process. Only informed citizens can neutralize anti national forces and narratives and to achieve informed citizen status, libraries - public libraries are quintessential. This is the big job in which the ministry is engaged, I compliment. I'm tempted to quote Rabindranath Tagore, "Books are the windows to the world." Nothing can be more pragmatic and realistic than this.

You go to a library, you open a book and you realize you opened a window to the world. A library is a temple of learning, a place

where the human mind goes to worship. Now, I'm sharing something not out of concern but only to seek your involvement.

Parliament is also the temple, a temple where debate, discussion, dialogue has to take place. No one expects parliament to be engaged in disturbance; you want your representatives to function in national interest. I am working in that direction. We have enormously talented people in Parliament. They bring on the table huge experience. I want that to be utilized for national purposes. But if our parliamentary system, temples of democracy do not engage in dialogue and discussion, they are plagued by disruption and disturbance, and the space is not going to be vacant and it will be occupied by forces that are always at in a manner to keep interest of the nation first and commit ourselves in an imperative manner to our duties. Well thought out National Mission on Libraries was launched in 2014. It has been very impactful. I'm sure greater vigor will be invigorated in this to achieve a level where we can reach the village also. I'm sure an execution plan for the development of modern libraries right down to the village community level would be functional. The only transformational mechanism that is available historically to change our civilization's growth is education. It is education that leads to research. It is education that activates innovation. Execution is not difficult but generating a concept is always difficult. Education and knowledge are twins. The mechanism which is being evolved will put them in the right perspective and people will benefit thereby. Imagine long back 1000s of years back there was an urge in the human genius to ensure that there is dissemination of knowledge and preservation of knowledge and they took to palm leaf manuscripts. I had the occasion to see them in the National Library in Kolkata. Look at the great effort that has gone into it. Thanks to technological developments, things are much better now. We must employ technology so that dissemination and preservation of knowledge takes the public interest to a very high elevated level. Ongoing efforts to employ technology for libraries are greatly appreciated because impact is being felt. As a matter of fact, it is necessary that Digital Library initiatives break barriers, empowering all citizens with access to knowledge. Let me put it to you. If you examine the growth history of India, from the 1950s in any walk of life, that is tech industry, the top 10 industrial houses in the 50s, how many of them have survived? And you will come to a conclusion immediately that in every decade, there was an addition on account of knowledge, technology and in the current decade the situation is that fresh talent is dominating Indian industry. That is the power of knowledge. Library Development brings about the development of a society and culture. It is also a measure of the progress of civilizations and our growth history. I must compliment the Honourable Minister and the Secretary on this coffee table book. Before coming here, I gathered some inputs but look at the coffee table book; I just glanced at it, I am sure you will be 100% focused, it is an unusual coffee table book. It is virtually the most authentic record of Indian genius for freedom, for our value system.

ZODIAC ENERGY LIMITED

CIN: L51909G1992PLC017694

Regd. Office: U.G.F-4,5,6, Milestone Building, Near Khodiyar Restaurant, Near Drive In Cinema, Thaltej Ahmedabad - 380054

Phone: +91 - 79 - 2747 1193 / 17, E-mail: ca@zodiacenergy.com; Website: www.zodiacenergy.com

Extract of Unaudited Financial Results for the quarter ended on June 30, 2023

Particulars	Quarter ended on 30/06/2023		Year ended on 31/03/2023	
	Unaudited	Audited	Unaudited	Audited
Total Income from Operations	3254.43	6224.96	2491.62	13849.62
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	114.87	244.16	(121.86)	438.20
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	114.87	244.16	(121.86)	438.20
Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	81.88	161.28	(120.73)	318.94
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	81.88	161.28	(120.73)	318.94
Equity Share Capital	1463.34	1463.34	1463.34	1463.34
Reserves (including Revaluation Reserve as shown in the audited Balance Sheet of the previous year)				2141.70
Earnings Per Share (or Rs 10/- each) (for continuing and discontinued operations)	0.56	1.10	(0.83)	2.18
Basic (not annualized for the quarter ended)	0.56	1.10	(0.83)	2.18
Diluted (not annualized for the quarter ended)	0.56	1.10	(0.83)	2.18

Note: The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the National Stock Exchange of India Limited and BSE Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly Financial Results are available on the Website of BSE Limited at www.bseindia.com, www.nseindia.com and Company's website at www.zodiacenergy.com

For, Zodiac Energy Limited
Kunjibihari Shah
Managing Director (DIN: 00622460)

Nagpur- Seoni Express Way Private Limited

CIN: U45203GJ2007PT049963

Regd. Office: "Sadbhav House", Opp. Law Garden Police Chowki, Ellisbridge, Ahmedabad-380006

Extract of Unaudited Financial Results for the quarter ended 30th June, 2023

S.No.	Particulars	For the quarter ended		For the year ended	
		June 30, 2023 (Unaudited)	June 30, 2022 (Unaudited)	March 31, 2023 (Audited)	March 31, 2022 (Audited)
1	Total Income from operations (face)	159.33	125.62	741.11	2,647.88
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(325.20)	(298.18)	(2,561.03)	(1,124.30)
3	Net Profit/(Loss) for the period (before Tax and after Exceptional and/or Extraordinary Items)	(325.20)	(298.18)	(2,561.03)	(1,124.30)
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(325.20)	(298.18)	(2,561.03)	(1,124.30)
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	(325.20)	(298.18)	(2,561.03)	(1,124.30)
6	Paid up Equity Share Capital (Face value of Rs. 10 each)	4,800.00	4,800.00	4,800.00	4,800.00
7	Reserves (Excluding Revaluation Reserve)	(11,875.13)	(9,988.61)	(11,351.95)	(8,770.43)
8	Securities Premium Account	-	-	-	-
9	Net Worth	(6,875.13)	(4,288.61)	(6,551.95)	(3,970.43)
10	Paid up Debt Capital / Outstanding Debt	11,788.02	13,500.26	11,788.02	13,500.14
11	Outstanding Redeemable Preference Shares	-	-	-	-
12	Debt Equity Ratio	2.48	2.81	2.45	2.81
13	Earnings Per Share (or Rs. 10/- each) (for continuing and discontinued operations)	(0.68)	(0.92)	(5.34)	(2.34)
14	Capital Revaluation Reserve	-	-	-	-
15	Debit Redemption Reserve	1,257.90	1,257.90	1,257.90	1,257.90
16	Debt Service Coverage Ratio	2.35	-	0.53	0.65
17	Interest Service Coverage Ratio	1.77	1.68	1.07	0.85

Note: The above is an extract of the detailed format of quarterly/Annual Financial Results filed with the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly Financial Results is available on the website of the Stock Exchanges, (www.bseindia.com) at (<https://www.bseindia.com/xml-data/corpling/AttachFile/1399271-3724-4072-991b-0b31fa8ad2.pdf>)

For Nagpur-Seoni Express Way Private Limited
SD/-
Amitabh Kumar Jha
Director
(DIN: 07130355)

Place: Chennai
Date: August 10, 2023

PHYSICAL POSSESSION NOTICE

Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No 1
Plot No - 83, W/Fl ITI Park, Wagle Industrial Estate, Thane, Maharashtra-406004

Whereas the undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation, Reconstruction and Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued demand notices upon the Borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules from the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower (as per Account Number)	Description of Property/ Date of Physical Possession	Date of Demand Notice (Rs.)	Name of Branch
1.	Payal Ramjiibhai Zakhariya/ Ashmita Hasamukhbaai Zakhariya/ LBSUR00002928156	House No. 117, Avadh Kambli, 2 Society, Plot No. 83, W/Fl ITI Park, Wagle Industrial Estate, Thane, Maharashtra-406004, 06/23	August 27, 2021 Rs. 36,38,588.00/-	Surat
2.	Darshna Alpesh Kanani/ Rashiela Mahurbaai Kanani/ Rasalaba Mahurbaai Kanani/ Aarav Enterprises/ Mathurbaai Kanani/ Rasalaba Kanani/ LBSUR00005164436	Property 1 - Shop No 316, Bldg No Evooq, 3rd Floor, Final Plot No 89, Sub Plot No A, Block No 128, Rs No. 87/2, Palanpur, Opp. Arhant Heights, Behind Shreepad Gaurav Path, Pal, Surat- 395010. Property 2 - Shop No 319, Bldg No Evooq, 3rd Floor, Final Plot No 89, Sub Plot No A, Block No 128, Rs No. 87/2, Palanpur, Opp. Arhant Heights, Behind Shreepad, Gaurav Path, Pal, Surat- 395010. 06/23	March 27, 2021 Rs. 33,72,785.99/-	Surat
3.	Koshiya Parulben Sanjaybhai/ Koshiya Ranjibhai Sanjaybhai/ LBSUR00004703266	Flat No -504, 5th Floor, Building-C, Param Residency, Plot No. 15/45B, Sector-1, Laskana Police Station, Sarthana-Kamrej Road, Block No. 102A/1 To 5, M/je Village Laskana, Taluka Kamrej, Dist. Gujarat, Surat- 395006- August 06, 2023	February 15, 2023 Rs. 8,56,102.00/-	Surat
4.	Keshubhai Shambhubhai Dabhi/ Jaysukhbhai Shambhubhai Dabhi. LBSUR00002023285	157, 6rd Floor Mahavir Residency Vedant Bhumi Residency, Kamrej, 615, Gujarat, Surat- 395001- August 06, 2023	June 25, 2021 Rs. 17,98,433.00/-	Surat
5.	Jagdishbhai Kalubhai Khunt/ Sumteelabhai Jagdishbhai Khunt- LBSUR00002698245	Flat No 303, Bldg No. F/2, 3rd Floor, Star Dharm Residency, Pasodara Char Rashtia, Nr Shubham Row House, Survey No. 70, Block No.82, To Scheme No.45, Flt No.61, Village-Navagam, Surat 394190- August 06, 2023	September 06, 2021 Rs. 14,33,192.00/-	Surat

The above-mentioned borrowers(s) (guarantors) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: August 11, 2023
Place: Surat
Authorized Officer
ICICI Bank Limited

SHANTAI INDUSTRIES LIMITED

CIN: L74110GJ1986PLC013255

Reg. Office: 820, Golden Point, Nr. Telephone Exchange, Begampura, Falsawadi, Ring Road, Surat-395002. Tel: 9913425000

Website: www.shantaindustrieslimited.com, Email-id: shantaindustriesltd@gmail.com

Extract of Unaudited Financial Result for the quarter ended 30th June, 2023

Sl. No.	Particulars	Quarter ended 30th June 2023		Quarter ended 30th June 2022		Year Ended on 31st March, 2023	
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)
1	Total Income from Operations	-	32.43	-	1.87	62.285	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	-5.938	-4.900	-0.946	-9.544		
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	-5.938	-4.900	-0.857	-9.569		
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	-5.938	-4.900	-0.857	-9.569		
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-5.938	-4.900	-0.857	-9.569		
6	Paid-up Equity Share Capital (face value of Rs. 10/- each)	150,000	150,000	150,000	150,000		
7	Reserve (excluding Revaluation Reserve)	-	-	-	-	592.203	
8	Earnings Per Share (face value of Rs. 10/- each) (for continuing and discontinued operations)	-0.396	-0.327	-0.057	-0.638		
1.	Basic	-0.396	-0.327	-0.057	-0.638		
2.	Diluted	-0.396	-0.327	-0.057	-0.638		

Note: The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at www.shantaindustrieslimited.com.

2. The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 05th August, 2023.

3. The limited review as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company.

Date: 10.08.2023
Place: Surat

For Shantai Industries Limited
SD/-
Harishbhai Fatandas Sawani
(Managing Director)
(DIN: 00831848)

SHRIRAM HOUSING FINANCE LIMITED

Reg. Off.: Office No.123, Angappa Naicken Street, Chennai-600011
Head Office: Level 3, Woodchurn Towers, East Wing, C-2, G Block, Bandra-Kurla Complex, Mumbai 400 051
Website: www.shriramhousing.in

SYMBOLIC POSSESSION NOTICE

Whereas, the undersigned being the authorised officer of Shriram Housing Finance Limited (SHFL) under the provisions of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (said Act) and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 (said Rules) issued demand notices to the Borrowers details of which are mentioned in the table below to repay the amount mentioned in the said demand notices.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken SYMBOLIC POSSESSION of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on 09/08/2023.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of Shriram Housing Finance Ltd. for an amount as mentioned herein below with interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the second assets.

Borrower/Co-Borrower Name & Address	Amount due as per Demand Notice	Description of Property
1. Vishal Rajesh Pandey, 2.Rambha Devi Rajesh Pandey, 3.Rajesh Pandey Address: 105, Aradhana Lake Town-4, Johva Gam, Palansva, Surat-394315	Rs. 14,73,432/- (Rupees Fourteen Lakh Seventy Three Thousand Four Hundred Thirty Two Only) as on 11/05/2023	All that right, title and interest in non-agricultural plot of land in Moje : Haldhara, lying land bearing R.S.No.130, Old Block No.151, New Block No.163/B, measuring 10314 Sq.Mtrs., known as "RAOHE RESIDENCY" palki Plot No.98, as per K.J.P. Block No.163/B/98, open land measuring 62.97 Sq.Mtrs., and C.O.P. undivided share of land measuring 42.33 Sq.Mtrs., Register District and Sub District Kamrej at District Surat.
Also Address:- 98,Raohe Residency, Moje-Haldhara, Taluka,Kamrej, Surat-394310	Rs. 7,23,143/- (Rupees Seven Lakh Twenty Three Thousand Two Hundred Thirty One Only) as on 11/05/2023 under reference of Loan Account No. SHLHSRA1000109	All that piece and parcel of the immovable property bearing Plot No.103(A) Block K. J. P. New Block No.31/103), together with undivided proportionate share admt. 21.75 Sq.Mtrs situated on the land bearing 62.97 Sq.Mtrs., Road and C.O.P. undivided share of land measuring 42.33 Sq.Mtrs. Register District and Sub District Kamrej at District Surat.
Also Address:- 1. Ambika w/o Haridas, 2.Ambika d/o Chhappan Haridas, 3.S.Kuttappan Chattan, Address No.1,2,-D-22, 1st Floor, Kailash Nagar, Behind Mahadev Nagar Society, Sagarpura, Near White House, Near J.P.Khaman, Surat-395002	Rs. 14,73,432/- (Rupees Fourteen Lakh Seventy Three Thousand Two Hundred Thirty One Only) as on 11/05/2023 under reference of Loan Account No. SHLHSRA1000109	Boundaries of the property East :- By Society Limit North :- Plot No.97 West :- By Society Internal Road, South :- By Plot No.99
Also Address No.1,2,-E-4,1st Floor, Kailash Nagar, Behind Mahadev Nagar Society, Sagarpura, Near White House, Near J.P.Khaman, Surat-395002	Rs. 7,23,143/- (Rupees Seven Lakh Twenty Three Thousand Two Hundred Thirty One Only) as on 11/05/2023 under reference of Loan Account No. SHLHSRA1000109	Boundaries of the property East :- By Society Limit North :- Plot No.97 West :- By Society Internal Road, South :- By Plot No.99
Also Address No.1,2,-F, 1st Floor, Kailash Nagar, Behind Mahadev Nagar Society, Sagarpura, Near White House, Near J.P.Khaman, Surat-395002	Rs. 7,23,143/- (Rupees Seven Lakh Twenty Three Thousand Two Hundred Thirty One Only) as on 11/05/2023 under reference of Loan Account No. SHLHSRA1000109	Boundaries of the property East :- By Society Limit North :- Plot No.97 West :- By Society Internal Road, South :- By Plot No.99
Also Address:- No.1,2,- G, 1st Floor, Kailash Nagar, Behind Mahadev Nagar Society, Sagarpura, Near White House, Near J.P.Khaman, Surat-395002	Rs. 7,23,143/- (Rupees Seven Lakh Twenty Three Thousand Two Hundred Thirty One Only) as on 11/05/2023 under reference of Loan Account No. SHLHSRA1000109	Boundaries of the property East :- By Society Limit North :- Plot No.97 West :- By Society Internal Road, South :- By Plot No.99
Also Address:- No.1,2,- H, 1st Floor, Kailash Nagar, Behind Mahadev Nagar Society, Sagarpura, Near White House, Near J.P.Khaman, Surat-395002	Rs. 7,23,143/- (Rupees Seven Lakh Twenty Three Thousand Two Hundred Thirty One Only) as on 11/05/2023 under reference of Loan Account No. SHLHSRA1000109	Boundaries of the property East :- By Society Limit North :- Plot No.97 West :- By Society Internal Road, South :- By Plot No.99

Place: Surat
Date: 09-08-2023

SD/-
Authorised Officer
Shriram Housing Finance Limited

